https://archive.org/details/bk1399/page/n0/mode/1up

2022-07 -Patidar Saurabh (1399)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

જુલાઈ-૨૦૨૨

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ. ૪૫૦

કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ મહામંત્રી અક્ષર નિવાસી થયા

કેકેપી સમાજમાંથી પીરાણા સતપંથનો ખાત્મો શા માટે નથી થતો ?

ભુજ સમાજના ત્રિવેણી મહોત્સવની શાનદાર ઉજવણી

સનાતન મેડીકોઝનું આગામી સ્નેહમિલન ૨૯-૩૦ ઓક્ટોબરે

કોટડાના પાટીદારોને જયારે જાતે વતું કરવાનો વારો આવ્યો !
કરાંચી પરિષદનું રસપ્રદ પ્રકરણ...

મિશન રાજકીયની શરૂઆત ગાંધીનગરથી !

નખત્રાણામાં પાટીદાર કલાકારોનો સંગીત મેળાવડો

realpatidar.com

https://archive.org/details/bk1399/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 3.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1399/page/n2/mode/1up

2022-07 -Patidar Saurabh (1399)

Real Patidar
Unravel Truth

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:53:03 +05'30'

realpatidar.com

જુલાઈ-૨૦૨૨

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ. ૪૫૦

કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ મહામંત્રી અક્ષર નિવાસી થયા

કેકેપી સમાજમાંથી પીરાણા સતપંથનો ખાત્મો શા માટે નથી થતો ?

ABKKP SANATAN MEDICOS

સનાતન મેડીકોઝનું આગામી સ્નેહમિલન ૨૯-૩૦ ઓક્ટોબરે

ભુજ સમાજના ત્રિવેણી મહોત્સવની શાનદાર ઉજવણી

કોટડાના પાટીદારોને જયારે જાતે વતું કરવાનો વારો આવ્યો !
કરાંચી પરિષદનું રસપ્રદ પ્રકરણ...

મિશન રાજકીયની શરૂઆત ગાંધીનગરથી !

નખત્રાણામાં પાટીદાર કલાકારોનો સંગીત મેળાવડો

realpatidar.com

https://archive.org/details/bk1399/page/n3/mode/1up

realpatidar.com

પાટીદાર સૌરભ

કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના ગૌરવવંતા મહાનુભાવને અપાશે "પાટીદાર સૌરભ" એવોર્ડ

કચ્છથી કન્યાકુમારી અને કોલકત્તા સુધી ફેલાયેલા વિશાળ સમાજમાં જ્ઞાતિના અનેક ભાઈઓએ ખમીર સાથે સંઘર્ષ કરી વ્યાપાર-વાણિજય અને ઉધોગ ક્ષેત્રે નામના કાઢી છે અને જન્મ ભોમકાનું નામ રોશન કર્યું છે.

ભારતભરમાં સંગઠિત સમાજ દ્વારા કચ્છ અને ગુજરાતનું નામ ગૂંજતું કરનાર કેકેપી સમાજના ભાઈઓને વિવિધ ક્ષેત્રોમાં તેમની નોંધપાત્ર સિદ્ધિ પ્રદાન બદલ "પાટીદાર સૌરભ" એવોર્ડ આપી તેમની વિશિષ્ટ સિદ્ધિઓને બિરદાવવાનું પાટીદાર સૌરભે નક્કી કરેલ છે.

જ્ઞાતિ માટે ઐતિહાસિક ગણી શકાય તેવી કરાંચી પરિષદના શતાબ્દી વર્ષની ઉજવણી અને પાટીદાર સૌરભ મુખપત્રના ૩૨મા વર્ષના પ્રવેશ નિમિત્તે જ્ઞાતિના તેજસ્વી તારલા જેવા મહાનુભાવોની પીઠ થાબડવાનો ઐતિહાસિક અવસર સાંપડયો છે તે સમગ્ર સમાજ માટે અહોભાગ્યની વાત છે.

આ વખતે (૧) સનાતન જાગૃતિ (૨) સામાજીક સેવા (૩) સાહિત્ય-પત્રકારીત્વ (૪) ઉધોગ-વેપાર અને (૫) કળા કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. આ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર કે અનન્ય સેવા આપનાર મહાનુભાવોના નામ પસંદ કરી તેમને એવોર્ડ આપવામાં આવશે. નામની પસંદગી માટે એવોર્ડ સમિતિ તો બનાવવામાં આવશે જ પણ આપ પણ ઉપરોક્ત કેટેગરી માટે નામનું સૂચન કરી શકો છો.

એવોર્ડ ફંકશન માટેની તારીખ / સમય અને સ્થળની જાહેરાત પાછળથી કરવામાં આવશે.

કચ્છી કડવા પાટીદારનો ધબકાર ઝીલતું મેગેઝીન

www.patidarsaurabh.com | Email : patidarsaurabh24@gmail.com | Mobile : 9724839106

realpatidar.com

https://archive.org/details/bk1399/page/n4/mode/1up

realpatidar.com

Why Pirana Satpanth Issue does not get resolved #History

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી

પીરાણા સતપંથનો ખાત્મો શા માટે નથી થતો?

રમેશભાઈ માવજીભાઈ વાગડિયા (બેંગલોર)

આ એક પેચીદો સવાલ છે અને તેના જવાબો પણ એવા જ પેચીદા હોઈ શકે છે જેને પચાવવા આપણા સૌને માટે અઘરા છે પણ જરૂરી છે. વરસોથી ઘર કરી ગયેલા રોગને મટાડવા માટે નાછુટકે કડવી દવાઓનું સેવન કરવું અનિવાર્ય હોય છે. તો ચાલો આપણે ઉપરના પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ અને જવાબોની સમીક્ષા કરીએ.

આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીની ભીષ્મ પ્રતિજ્ઞા :

જે વ્યક્તિની આપણે પૂજા કરીએ છીએ, જે પૂજનીય વ્યક્તિનો આપણે આદ્ય સુધારક તરીકે કેન્દ્રીય સમાજ, ઝોન સમાજથી લઈને દરેક ઘટક સમાજોમાં ફોટો ટીંગાડીને તેને માન ભરી નજરે નિહાળીએ છીએ તે વ્યક્તિએ સતપંથ બાબતમાં શું કહ્યું હતું તેનો વિચાર તો આપણે કરતા જ નથી. તો પછી તે વ્યક્તિને આદ્ય સુધારક તરીકે નિહાળવાની શું જરૂરત છે? શું તેમને જ માત્ર પીરાણા સતપંથ ધર્મ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ હતી? ના, તેમને ચિંતા હતી સમગ્ર કચ્છ કડવા પાટીદારની કે પીરાણા સતપંથને લઈને આખી જ્ઞાતિ અધોગતિ તરફ જઈ રહી હતી. તેમને ચિંતા હતી જ્ઞાતિની ઓળખ હિંદુ તરીકેની મટીને એક મુમના મુસલમાન તરીકેની થઈ જવા જઈ રહી હતી. જ્ઞાતિને સતપંથમાંથી છોડાવીને સમગ્ર કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને મૂળ હિંદુ ધર્મમાં પાછી લઈ આવવાની પ્રતિજ્ઞા એમણે લીધી હતી.

આજથી લગભગ સો એક વરસ પહેલાં આદ્ય સુધારક નારાયણજી રામજી લીંબાણીએ સતપંથ બાબતમાં બોલતાં કહ્યું હતું કે "કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને

હિન્દુંપણાથી દુર કરનાર એ પાપી પાખંડી પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી દુર કરવાના સર્વે પ્રયત્નો હું કરીશ અને તેમ કરતાં તેમ મારા આ જન્મારામાં ન થયું તો ફરી પાછો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ લઈને તે પાપી પીરાણા સતપંથનું જ્ઞાતિમાંથી નિકંદન કાઢી નાખીશ."

આવી ભીષ્મ પ્રતિજ્ઞા નારાયણજી બાપાએ તે સમયે લીધી હોવા છતાં આપણે તેમ (જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો) કરી નથી શકતા તેના કારણો શું હોઈ શકે છે? તેની વિસ્તૃત ચર્ચા આપણે આજે કરવાની છે. તેનું ચિંતન અને મનન આપણે આજે કરવાનું છે. જ્ઞાતિમાંથી સતપંથને ઉખેડી ફેંકવા માટે ચાર ચાર વખત જ્ઞાતિમાં સનાતની મુહિમો થવા છતાં હજી સુધી આપણને સંપૂર્ણ સફળતા મળતી નથી. શા માટે નથી મળતી? તેની વિગતવાર ચર્ચા આપણને આજે કરવાની છે. આ ચર્ચા અગત્યની છે એટલી જ જરૂરી પણ છે કારણ કે હવે પછી આપણી સનાતની જ્ઞાતિમાં અને સનાતની સમાજમાં આવનાર પેઢીને પીરાણા સતપંથવાળો પ્રશ્ન મુકીને નથી જવું. હવે આરપારની લડાઈ લડવાનો સમય આવી ગયો છે. યા તો જ્ઞાતિમાંથી પીરાણા સતપંથને કાયમને માટે નાબુદ કરવાનો છે અથવા તો પીરાણા સતપંથ મુક્ત સમાજ બનાવીને સતપંથીઓને આખરી પ્રસ્તાવ આપવાનો છે. નાતની સર્વોચ્ચ સંસ્થાએ (કેન્દ્રીય સમાજે) એવો ફતવો બહાર પાડવો જોઈએ કે ફલાણી તારીખ સુધી જે સતપંથના ભાઈઓને પીરાણા સતપંથનો અને સતપંથ સમાજનો સંપૂર્ણ પણે ત્યાગ કરીને સમાજના સનાતની પ્રવાહમાં ભળી જવું હોય તો ભળી જઈ શકે છે, ત્યાર પછી એવા લોકો માટે સનાતની નાતમાં જોડાવાના દરવાજા કાયમને માટે બંધ કરી દેવામાં આવશે. મુકરર કરેલી તારીખ પછી તે સતપંથના પરિવારોને આકાશ-પાતાળ એક કરવા છતાં સનાતની નાતમાં ભેળવવામાં આવશે નહિ. જેને ભળવું હોય તે અત્યારે ભળી જાય, પાછળથી કોઈ કાળે ભેળવવામાં આવશે નહિ. આવો આખરી પ્રસ્તાવ કેન્દ્રીય સમાજને પારિત કરવાનો સમય હવે આવી ગયો છે.

હવે મૂળ વાત ઉપર આવીએ કે આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી સતપંથનો સંપૂર્ણપણે સફાયો શા માટે નથી થતો. તેના મુખ્ય કારણો નીચે પ્રમાણેના છે.

(૧) ધાર્મિક કટ્ટરતાની ખામી :

જેવી રીતે ભારતમાંથી હિન્દુઓની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સનાતની ભાઈઓની છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવું હશે તો ભારતમાં રહેતા

realpatidar.com

https://archive.org/details/bk1399/page/n5/mode/1up

2022-07 -Patidar Saurabh (1399)

realpatidar.com

તમામ હિન્દુઓએ હિન્દુ ધર્મ પ્રત્યે ધાર્મિક કટ્ટરતા દાખવી જેટલી જરૂરી છે તેટલી અથવા તો તેનાથી પણ વધારે ધાર્મિક કટ્ટરતા આપણી સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને એક સાચા સનાતની હિંદુ તરીકે સતપંથ વિરુદ્ધ ધાર્મિક કટ્ટરતા દાખવવી જરૂરી છે. આવી ધાર્મિક કટ્ટરતા આવે ક્યાંથી? બજારમાંથી વેચાતી તો તે મળતી નથી, તો પછી કટ્ટરતા લાવવી ક્યાંથી? તે માટે દરેક સનાતની ભાઈએ પોતાની ફરજ સમજીને જાતે જ કટ્ટરતા અપનાવવી પડશે. દરેક સનાતનીને પોતે સ્વયમ્ ધાર્મિક રીતે કટ્ટર રહેવું પડશે. આપણી સમાજે સતપંથ સનાતન બાબતે બનાવેલા નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. સનાતની સિદ્ધાંતોને દરેક સનાતનીએ દઢતાપૂર્વક વળગી રહેવું અત્યંત જરૂરી છે. પણ તેમ આપણે અત્યારે કરી શકતા નથી તે આપણી કમજોરી છે. સનાતની સિદ્ધાંતોને વળગી રહેવાની જવાબદારી ફક્ત આમ સનાતની ભાઈઓની જ નથી પણ ઉપરી હરોળમાં બેઠેલા તમામ મોવડીઓની પણ એટલી જ જવાબદારી બને છે. હાલ તો તાજેતરનો જ દાખલો આપણે લેશું તો સતપંથના કાકાઓ આપણા ધાર્મિક સંકુલોમાં આવ્યા જે મંજૂરી વગર તો આવી ન શક્યા હોત. આપણે જ ઠરાવો પારિત કરેલા જ છે કે પીરાણા સતપંથના કોઈ પણ પ્રોગ્રામમાં જવું અથવા તો પીરાણા સતપંથના લોકોને આપણા ઘરે (આપણા ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક સંકુલોમાં) બોલાવવા નિષેધ ફરમાવવામાં આવેલ છે. છતાં આપણે સતપંથના કાકાઓને આપણા ધાર્મિક સંકુલોમાં આવવા આડકતરી રીતે મંજૂરી આપી તે આપણી ધાર્મિક કટ્ટરતામાં ખામી જણાઈ આવે છે. આ ભૂલ આમ જોઈશું તો કાંઈ જ નથી થયું એવું કહીને ભૂલ કરનાર લોકો ભલે પોતાનો બચાવ કરી રહ્યા હોય પણ આવી ભૂલો થકી સમાજના સામાન્ય નાગરિકોમાં એટલી મોટી ગેરસમજણ ફેલાય છે અને પરિણામ સ્વરૂપે આપણી સતપંથ સામેની લડાઈમાં મોટી ઢીલાશ આવી જાય છે અને તેથી આપણી સનાતની લડાઈ ઉપર અવળી અસર પડે છે. સતપંથીઓ આવાં ગતકડાં કરવામાં તો માહિર છે. આપણને સાવચેતી રાખવાની જરૂરત છે.

(૨) મવાળવાદીઓ દ્વારા સતપંથીઓને છાવરવાની પ્રવૃત્તિઓ :

ક્યારેક તો સતપંથી ભાઈઓ આપણને હેરાન નથી કરતા તેનાથી વધારે હેરાનગતિ આપણને આ મવાળવાદીઓ કરતા હોય છે. આમ તો આ મવાળવાદીઓ પોતાને સનાતની તરીકે ઓળખાવે છે પણ કોણ જાણે કેમ આ લોકોને સનાતની સિદ્ધાંતોમાં બાંધછોડ કરવાની પેરવીઓ તેઓ હંમેશા કરતાં રહીને સનાતની લડાઈને ઢીલી કરવામાં તેઓ પાશવી આનંદ લેતા રહે છે. આવા લોકોને આપણે ઓળખી શકતા નથી અને ઓળખી લેવા છતાં તેની સામે કોઈ શિક્ષાત્મક - દંડાત્મક પગલાં લઈ નથી શકતા તે આપણી નબળાઈ દર્શાવે છે.

(૩) સગાંવાદ સામે સનાતની ભાઈઓના ગુડા ટેકણાં :

સામાન્યપણે આવા લોકો પોતાને સનાતની તરીકે ઓળખાવે છે અને તેઓ સનાતની જ છે પણ ખરા પણ જ્યાં સગાંવાદનો પ્રશ્ન આવે છે ત્યારે તેઓ લાચાર બની જાય છે અને કાયદામાં છીંડાં ગોતવાનો સતત પ્રયત્ન કરીને સનાતની લડાઈને નબળી પાડવામાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે મદદરૂપ થતા હોય છે. જાણે સગાં તરીકે સતપંથના ભાઈઓ જોડે સંબંધો જાળવવાનો ઠેકો સનાતની ભાઈઓએ જ લીધો હોય. શું સતપંથી સગાંઓને બાંધછોડ કરવાની જવાબદારી નથી. આ સનાતની સગાંઓની નબળી કડી છે તેમાં સતપંથી સગાં હંમેશા ફાયદો ઉઠાવતા હોય છે. જુના સંબંધો બંધાઈ ગયા હોય તે તો ઠીક છે પણ નવેસરથી સતપંથી જોડે સામાજિક સબંધો બાંધવા તે નરી મૂર્ખાઈ જ છે. આ એક ધાર્મિક કટ્ટરતાની ખામી છે. તેને જો દૂર કરવામાં આવે તો સતપંથ સામેની લડાઈ આપણે જીતવામાં સફળ જલ્દીથી થઈ શકીએ એમ છે. અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી સતપંથને સંપૂર્ણપણે નાબૂદ કરવાના નારાયણજી બાપાના સપનાને સાકાર કરી શકીએ. આડકતરી રીતે સતપંથી સાથેનો સગાંવાદ પીરાણા સતપંથને જીવંત રાખવામાં પ્રાણવાયુ પૂરો પાડે છે અને પરિણામ સ્વરૂપે જ્ઞાતિમાંથી સતપંથ કાયમને માટે નાબૂદ થતો નથી. સગાંવાદથી સતપંથને સતત જીવતદાન મળતું રહે છે.

(૪) લડાઈ તમે લડો એ અમારું કામ નથી :

સતપંથ સામેની લડાઈ તમે લડો એવી નબળી માનસિકતા બહોળા સનાતની ભાઈઓમાં ઘર કરી ગઈ છે. ધાર્મિક લડાઈ કોઈ એકલ દોકલને લડવાનું કામ નથી. તે તો સામૂહિક રીતે સમસ્ત સનાતનીઓને લડવી પડે, તો જ આપણે તે લડાઈ જીતી શકીએ. દરેક સનાતની, તે પોતાની જવાબદારી સમજીને જો આ લડાઈ લડે તો કોઈ સતપંથીની મજાલ નથી કે તેઓ આપણી સામે ટકી શકે. આખરે, સતપંથીઓને મજબૂર થઈને આપણી સાથે સનાતની પ્રવાહમાં જોડાઈ જવું જ પડે અને આપણે જ્ઞાતિમાંથી સતપંથને કાયમને માટે નાબૂદ કરી શકીએ તેમાં બે મત નથી.

(૫) પલાયનવાદ વૃત્તિ અને આક્રમકતાનો અભાવ :

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો આ એક મહા ભયંકર રોગ કહી શકાય જે આપણું એક નકારાત્મક પાસું છે. જ્યારે સતપંથ સામે ઝઝૂમવાની વાત આવે છે ત્યારે આ જ્ઞાતિનો માણસ લડાઈ લડવા માટે જરૂરી ત્વરિત નિર્ણય નથી લેતો. પછી કરશું, શું જલ્દી છે હમણાં, આપણી લીટી લાંબી કરો, પહેલાં સમાજ વિકાસની વાતો કરો. સતપંથ સામે પછી પણ લડી લેવાશે આવી

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 4 of 7

https://archive.org/details/bk1399/page/n6/mode/1up

realpatidar.com

ડાહી ડાહી સૂફિયાણી વાતો કરવા લાગી જાય છે. પણ તેને ખબર નથી કે આ લડાઈ છેલ્લા ૨૦૦ વર્ષથી ચાલુ છે, છતાં પણ આપણે સંપૂર્ણ રીતે જીતી શક્યા નથી તેમાં આપણી પલાયનવાદ વૃત્તિ પણ એટલી જ જવાબદાર છે જેટલાં અન્ય કારણો જવાબદાર છે. કોઈ પણ લડાઈ હોય ભલે પછી તે લડાઈ સતપંથ સામેની હોય કે અન્ય લડાઈઓ હોય, તે લડાઈઓ તો જીતી જ શકાય જો આપણે આક્રમક વૃત્તિ (મારક વૃત્તિ) અપનાવીએ. મુસલમાનની જેમ "મારો સાલે કો" જેવી મારક વૃત્તિ આપણને પણ અપનાવવી જોઈએ તો જ આપણે સતપંથને આપણી જ્ઞાતિમાંથી નાબુદ કરીને નારાયણજી બાપાના સપનાને સાકાર કરી શકીશું અન્યથા તે શક્ય નથી.

(૬) આપણી ત્રણે મુખ્ય સંસ્થાઓનો સતપંથ સામે સમન્વયતાથી એક અવાજે કામ કરવાનો અભાવ :

આપણી કેન્દ્રીય સમાજ (શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ) અને તેના દ્વારા સમય સમયાંતરે ઊભી કરવામાં આવેલ બે ધાર્મિક સંસ્થાઓ શ્રી વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાન અને શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન દેશલપર, જો સતપંથ સનાતન મુદે એકજૂટ થઈને એક અવાજે કામ નહીં કરે તો સતપંથને આપણે આપણી જ્ઞાતિમાંથી નાબૂદ કરી શકવાના નથી તે દેખીતી વાત છે. જ્યારે સતપંથ-સનાતનની વાત હોય ત્યારે આપણે જ બનાવેલા સનાતની સિદ્ધાંતોમાં બાંધછોડ જો થતી રહેશે તો સતપંથ સામેની લડાઈ જીતવામાં આપણને સમય લાગવાનો છે તે હકીકત છે. જેમ સમય વધારે જશે તેમ જ્ઞાતિમાંથી સતપંથને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનું કામ અઘરું બનતું જશે. આપણો રવૈયો જો આવો જ રહ્યો તો જેમ અનેક પેઢીઓ નીકળી ગઈ અને અનેક પેઢીઓ ભવિષ્યમાં હજી નીકળી જવાની છે તે હકીકત છે. હવે આપણને જ્ઞાતિમાંથી આ પ્રશ્ન ભવિષ્યની પેઢીને નથી દઈ જવો. તે માટે અત્યારની વર્તમાન પેઢીને આરપારની લડાઈ લડી લેવી પડશે એવું મારું માનવું છે.

(૭) આપણી ત્રણે સંસ્થાઓના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓને જ્ઞાતિના અને સમાજના સાચા ઈતિહાસનું જ્ઞાન હોવાનો અભાવ :

કોઈ પણ સંસ્થાના હોદ્દેદારોને હોદ્દો ધારણ કરતા પહેલાં તે સંસ્થાના અને જ્ઞાતિના સાચા ઈતિહાસનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. જ્ઞાન હોવું એટલા માટે જરૂરી છે કે સતપંથ બાબતે આપણી સનાતની સંસ્થાઓની શું જવાબદારીઓ બને છે તેનાથી તેઓ સતત વાકેફ રહે અને સમય સમયાંતરે જ્ઞાતિ અને સંસ્થાઓના હિતામાં સનાતન ધર્મ બાબતે યોગ્ય નિર્ણયો લઈને જ્ઞાતિમાંથી સતપંથને નાબૂદ કરવા માટે સદાય તત્પર અને કટિબદ્ધ રહે. જ્ઞાતિ અને સમાજના સાચા ઈતિહાસનું પૂરું જ્ઞાન સંસ્થાઓના ધુરીણોમાં ન હોવાને લીધે સતપંથ બાબતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય તેઓ સનાતની ભાઈઓના હિતમાં લઈ નથી શકતા. તે આપણી એક નબળાઈ છે. અનેક કારણોમાંનું આ પણ એક કારણ છે કે આપણે જ્ઞાતિમાંથી સતપંથને નાબુદ નથી કરી શકતા.

(૮) સનાતની લડયૈયાઓને રક્ષણ પૂરું પાડવાનો અભાવ :

સતપંથને જ્ઞાતિમાંથી નાબૂદ જો આપણને કરવું હશે તો સતપંથ સામે લડી રહેલા સમાજના સનાતની વીરોને દરેક જાતનું (કાનૂની, આર્થિક અથવા તો અન્ય રીતે) રક્ષણ પૂરું પાડવાની જવાબદારી કેન્દ્રીય સમાજ અને તેની અંતર્ગત આવતી તમામ સંસ્થાઓએ લેવી અત્યંત જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને આપણી બે ધાર્મિક સંસ્થાઓએ પીરાણા સતપંથ સામેની લડાઈમાં મોખરે રહીને તે જવાબદારી સુપેરે પાર પાડવી જરૂરી છે. આપણી બંને ધાર્મિક સંસ્થાઓની જવાબદારી બને છે કે તેઓ સનાતની લડવૈયાઓને સતપંથ સામે લડવા માટે દરેક જાતનું રક્ષણ પૂરું પાડે જેથી સતપંથ સામેની લડાઈ આપણે જીતી શકીએ અને જ્ઞાતિમાંથી સતપંથને આપણે નાબૂદ કરી શકીએ.

(૯) પરિવારવાદ એક અવરોધ :

ગામે ગામની પોતાની સમાજો હોવા છતાં, પરદેશમાં રહેતા હોય ત્યાં સ્થાનિક સમાજો હોવા છતાં આપણને પરિવારનો મોહ એટલો બધો છે કે ત્યાં આપણે સતપંથ સનાતનનો મુદ્દો જ ભૂલી જઈએ છીએ. પરિવારોમાં જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે સતપંથ સનાતનને મુદે કેન્દ્રીય સમાજે બનાવેલા કાયદાઓને નેવે મૂકી દેતા હોઈએ છીએ. પરિવારના નામે સતપંથના ભાઈઓ જોડે ગુડે બેસીને જમીએ છીએ. આવું બધું થતું હોય ત્યાં જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો કઈ રીતે શક્ય બને? આ સવાલ દરેક સનાતનીએ પોતાની જાતને પૂછવો જોઈએ. પરિવારવાદને બળ પૂરું પાડીને આપણે કેન્દ્રીય સમાજની નીતિઓને ઢીલી પાડી રહ્યા છીએ તે દરેક સનાતની ભાઈએ વિચારવું જોઈએ. હજી કેટલાંયે પરિવારોએ પોતાની સનાતની તરીકેની ઓળખ કાયમ કરી નથી. આવા પરિવારોમાં લોલમલોલ કુટાય છે. આ બંધ થવું જોઈએ તો જ આપણે જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો કરી શકીશું.

(૧૦) VHP, RSS અને ભાજપ તરફથી સતપંથને જીવતદાન :

જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો શા માટે થતો નથી તેનું હજી એક કારણ આપણે આપી શકીએ. અને તે કારણ છે પીરાણા સતપંથના લોકો પોતાનું ઈમામશાહવાળું તુત ચાલુ રાખવા માટે પૈસાના જોરે RSS, VHP અને ભાજપનો સહારો લઈને પીરાણા સતપંથને જીવંત રાખે છે.

આપણી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો આરએસએસ, વીએચપી અને ભાજપ સતપંથને સહારો ન આપ્યો હોત તો સતપંથ વહેલો જ વીંટાઈ ગયો હોત અને આપણી જ્ઞાતિ સતપંથ મુક્ત જ્ઞાતિ વહેલી બની ગઈ હોત. પણ અફસોસ છે કે તેઓ આ વાતને સમજતા નથી. આખરે તેઓ પણ પૈસાને જ ઓળખે છે. બીજું RSS જેવી સંસ્થાઓ પોતાના વિચારોમાં એમ રાચે છે કે પીરાણા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1399/page/n7/mode/1up

2022-07 -Patidar Saurabh (1399)

realpatidar.com

સતપંથવાળા ભાઈઓને અમે મુસલમાન થતાં બચાવીએ છીએ. તેમની ઘર વાપસી અમે કરાવી રહ્યા છીએ. આ VHP ની, આરએસએસની અને ભાજપની ભ્રાંત કલ્પના છે. સતપંથના ભાઈઓને મુસલમાન થતાં તો બચાવ્યા છે આપણા સુધારક વડીલોએ. જો તેઓ ન હોત તો ક્યારના આપણે સૌ સતપંથમાં રહીને મુમના મુસલમાન બની ગયા હોત.

તેવી જ રીતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન પણ તેમને સતપંથ બાબતે તેમનો ચુકાદો આપ્યા પછી થોડી ઘણી પણ સતપંથ સામે કડકાઈ બતાવી હોત તો પણ આપણી જ્ઞાતિના સતપંથી ભાઈઓને સતપંથ છોડીને આપણી સાથે ભળી જવા મજબૂર થવું પડત અને તેઓ પીરાણા સતપંથને મુકીને સનાતની થઈ ગયા હોત અને આપણી જ્ઞાતિમાંથી સતપંથને નાબૂદ કરીને આપણી જ્ઞાતિ સતપંથ મુક્ત જ્ઞાતિ બની ગઈ હોત.

(૧૨) સતપંથ અને સતપંથના ભાઈઓની તરફેણમાં વાતો કરવાનું બંધ કરીએ :

અમુક કહેવાતા સનાતની ભાઈઓની ખોટી ટેવ હોય છે કે સતપંથમાં આ સારું છે, પીરાણામાં તે સારું છે તેમ કહીને સનાતની સમાજને અને સનાતનીઓને ઉતારી પાડવાની કોશિશ કરતા રહે છે. તેમને એ ખબર નથી કે સનાતન ધર્મ અને સનાતન સમાજ આપણી મા છે. પોતાની મા ગમે તેવી હોય પણ બીજાની મા સાથે તેની સરખામણી કોઈ દિવસ ન કરાય. આવું બોલીને આપણા અમુક સનાતની ભાઈઓ આડકતરી રીતે પીરાણા સતપંથને જીવાડવામાં પ્રાણવાયુ પૂરો પાડતા હોય છે. કહેવાય છે કે મતિયા પાટીદારો પણ એક સમયે સતપંથમાં હતા. પણ જ્યારે તેઓને જ્ઞાન થયું કે સતપંથ એક મુસ્લીમ ધર્મનું ફાંટું છે અને તે મતિયા પાટીદાર જ્ઞાતિને લાયક ધર્મ નથી એટલે તેઓએ સામુહિક રીતે સતપંથનો ત્યાગ કર્યો અને ત્યાર પછી સતપંથ તરફ પાછું વાળીને જોયું નથી. આને કહેવાય સાચો ત્યાગ અને સમજણ. પણ કોણ જાણે કેમ આપણે કઈ માટીના ઘડાયેલા છીએ કે ઈમામશાહ બાવો પણ ૫૦૦ વરસમાં આપણને સંપૂર્ણ રીતે મુસલમાન બનાવી ન શક્યો અને આપણે પોતે પણ સતપંથમાંથી વટલાઈને સંપૂર્ણ જ્ઞાતિ સનાતની હિંદુ બની ન શકી. સતપંથ રૂપી થોડી ઘણી એંઠ તો આપણામાં રહી જ ગઈ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી માં ઉમિયા આપણી જ્ઞાતિને સદ્‌બુદ્ધિ આપે અને આપણી આખી જ્ઞાતિ પીરાણા સતપંથનો, ઈમામશાહ બાવાનો, સતપંથના શાસ્ત્રોનો અને સતપંથ સમાજનો સદંતરે ત્યાગ કરીને સમાજના સનાતની પ્રવાહમાં ભળી જાય એવી અભ્યર્થના સાથે મારા આ લખાણને વિરામ આપું છું.

(ભગવાન સૌનું ભલું કરે અને તેની શરૂઆત મારી જ્ઞાતિથી કરે)

કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ મહામંત્રી વાલજી હીરજી ચવાણનું દુઃખદ નિધન

કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ મહામંત્રી અને ટ્રસ્ટી તેમજ સત્સંગ સમાજના અગ્રણી વાલજીભાઈ હીરજીભાઈ ચવાણ દહાણુવાળાનું દુઃખદ અવસાન થયું છે, તેઓ ૭૬ વર્ષના હતા. તેઓ છેલ્લા શ્વાસ સુધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. કચ્છમાં તેઓ દયાપરના હતા અને હાલે મહારાષ્ટ્રના દહાણુ રોડમાં રહેતા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેન્સરની બીમારીમાં સપડાયા હતા. તબીબોની સારવાર કારગત ન નીવડતા તા.૨૪-૦૬-૨૦૨૨ના દહાણુ ખાતેના તેમના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા. તા.૨૫-૬ના સવારના તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમયથી સામાજિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેલા વાલજીભાઈ ચવાણનું લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના સંગઠન અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. તેઓ હાલમાં આ સંગઠનમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા.

કેન્દ્રીય સમાજમાં પણ તેમણે મંત્રી, મહામંત્રી અને છેલ્લે ટ્રસ્ટી તરીકેની સેવા બજાવી હતી. પોતાની સૌમ્ય અને સાલસ પ્રકૃતિના કારણે વાલજીભાઈ દહાણુવાળાએ દરેક સંસ્થાઓમાં સાથી કાર્યકરો સાથે આત્મિયતા કેળવી હતી.

કેન્દ્રીય સત્સંગ સમાજમાં પણ છેલ્લા પાંચ વર્ષથી તેઓ મહામંત્રીનું જવાબદારીભર્યું પદ સંભાળી રહ્યા હતા. તેમના અચાનક નિધનથી સત્સંગ સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું સમાજના પ્રમુખ હરિભાઈ ભગતે જણાવ્યું હતું.

પરમકૃપાળુ પરમાત્મા સદ્‌ગતના આત્માને પરમ શાંતિ અર્પે અને કુળદેવી મા ઉમિયા માતાજી, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન નીજ ચરણોમાં તેમને સ્થાન આપે તેવી પ્રાર્થના...

ૐ શાંતિ...ૐ શાંતિ... ૐ શાંતિ...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 6 of 7

https://archive.org/details/bk1399/page/n8/mode/1up

2022-07 -Patidar Saurabh (1399)

realpatidar.com

PATIDAR SAURABH (Monthly)

Regd. No. GKCH / 88 - A / 2021-2023 RNI No. GUJGUJ / 2001 / 6356
Published & Permitted to Post at Nakhatrana SO on 5th of Every Month



Printed, Published and owned by Neeta Patel and printed at Allied Offset, Gomtipur - Ahmmedabad and Published at Nakhatrana (Kachchh). Editor : C.K. Patel.

Sweta Offest Pvt. Ltd. Ph. 22940375

realpatidar.com